

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૧/૦૭/૨૦૧૬ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૨૦૭/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૫ કેસ કરી, ૨૮ વ્યક્તિઓને ઝડપી ૮૬ લીટર દેશી દારૂ, ૦૪ બોટલ ઇંગ્લીશ દારૂ, ૦૧ સ્કુટર અને ૦૧ કાર કબજે કરી હતી.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૨૦૮/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૯૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૩૮ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૨૦૯/૧૬

વટવા: નીમીષાબહેન મનીષભાઈ શાહ (રહે.હરીકૃષ્ણપાર્ક સોસાયટી, વટવા) એ તા.૩૦/૬/૧૬ નારોજ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૫/૧૨/૧૩ થી તા.૧૫/૩/૧૬ સુધીના સમયગાળા દરમિયાન આરોપી (૧) દક્ષાબહેન મુકેશભાઈ મકવાણા (રહે.હરીકૃષ્ણપાર્ક સોસાયટી, વટવા) (૨) જશુભાઈ એસ.મકવાણા (રહે.વણકરવાસ, વટવા ગામ) (૩) કિરણસિંહ જે.રાહોડ (રહે.વિંઝોલ ગામ, વટવા) ભેગામળી નીમીષાબહેન પાસેથી ડ્રો અને બાઇકનાં ડાઉન પેમેન્ટનાં કુલ રૂપિયા ૫૯,૦૦૦/- મેળવી લઈ, ડ્રો બંધ કરી દઈ, કોઈ રૂપિયા પરત નહીં કરી, નીમીષાબહેન તથા અન્ય સભ્યો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.એ.ગોહીલ ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૨૧૦/૧૬

મેઘાણીનગર : સોનલબહેન વા\ઓ જીતેન્દ્રભાઈ ખેરનાર (ઉ.વ.૨૮) (રહે.મોહનલાલ વકીલની ચાલી, ઘી વાળી ચાલી નજીક, ચમનપુરા) એ કોઈ અગમ્ય કારણસર તા.૩૦/૬/૧૬ ના કલાક ૮/૫૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે પોતાના સાસરીમાં ઘરે લોખંડની એંગલ સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ અંગે મેઘાણીનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી દિલીપસિંહ ગંભીરસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.